



સીટી હોલ અને કોર્પોરેટ સગવડો હવે માત્ર એપોઈન્ટમેન્ટથી ખુલ્લી છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 9, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં, સીટી હોલ સહિતની સીટીની કોર્પોરેટ સગવડો છ મહિના સુધી બંધ રહ્યાં પછી જાહેર જનતા માટે આજે માત્ર એપોઈન્ટમેન્ટથી ફરીથી ખોલવામાં આવી. અત્યારે, વોક-ઇનની પરવાનગી આપવામાં આવતી નથી.

શું ખુલ્યું છે (માત્ર એપોઈન્ટમેન્ટથી)

સપ્ટેમ્બર 9 થી શરૂ કરીને, નીચેના સ્થળો માત્ર એપોઈન્ટમેન્ટ-આધારિત સર્વિસીસ માટે ખોલવામાં આવ્યા છે:

- સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ
- સિવિક સેન્ટર, 150 સેન્ટ્રલ પાર્ક ડ્રાઇવ
- વિલિયમ્સ પાર્કવે ઓપરેશન્સ સેન્ટર, 1975 વિલિયમ્સ પાર્કવે
- એનિમલ સર્વિસીસ, 475 ક્રાઇસ્લર ડ્રાઇવ
- બિલ્ડિંગ ડિવિઝન અને એન્ફોર્સમેન્ટ અને બાય-લો સર્વિસીસની ઓફિસો, 8850 મેકલાફલિન રોડ સાઉથ

POA કોર્ટહાઉસ, 5 રે લોસન બુલેવર્ડ ગત જુલાઈ 6 થી ખોલવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/reopening

હવે ઉપલબ્ધ સર્વિસીસ

સપ્ટેમ્બર 9 થી અમલી બનેલી, નીચેની સર્વિસીસ રૂબરૂમાં માત્ર એપોઈન્ટમેન્ટથી ઉપલબ્ધ છે:

- મેરેજ લાઈસન્સીંગ
- બિઝનેસ લાઈસન્સીંગ અને સાઈન એપ્લિકેશન્સ
- મિલકત કર અને અન્ય ચૂકવણીઓ માટે કેશિયર કાઉન્ટર્સ
- પૂછપરછો માટે સર્વિસ બ્રેમ્પટન ડેસ્ક
- બિન-રહેવાસી અરજીઓ માટે બિલ્ડિંગ પરમીટ એપ્લિકેશન્સ, ઝોનિંગ સર્વિસીસ અને સાઈન પરમીટ્સ
- પ્રાણી દત્તક લેવું, લાઈસન્સીંગ અને પૂછપરછો

ઘણી સર્વિસીસ હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે અને સર્વિસીસ સુધી વેબસાઈટ www.brampton.ca પર અથવા 311 નંબર પર કોલ કરીને પહોંચી શકાય છે.

એપોઈન્ટમેન્ટ્સ બૂક કરાવવી

રૂબરૂમાં સીટી સર્વિસીસ સુધી પહોંચવા, એપોઈન્ટમેન્ટ્સ અનિવાર્ય છે.

સીટીની નવી ઓનલાઈન સર્વિસ *સ્કિપ ધી લાઈન* નો ઉપયોગ કરીને ઘણી એપોઈન્ટમેન્ટ્સ અહીં www.brampton.ca/skiptheline કરાવી શકાય છે.



સ્ક્રીનિંગ (તપાસ)-પૂર્વેના પ્રશ્નોના જવાબ આપ્યા પછી તમારી એપોઇન્ટમેન્ટ્સ બૂક, પુનઃનિર્ધારિત કે રદ કરાવો.

એપોઇન્ટમેન્ટમાં હાજર રહો ત્યારે:

- તમે તમારી એપોઇન્ટમેન્ટ માટે આવતા પહેલાં તમારી પાસે બધાં જરૂરી દસ્તાવેજો હોવાની ખાતરી કરો.
- સમયસર આવો – ચૂકી જવાયેલી કે વિલંબિત એપોઇન્ટમેન્ટ્સ ભવિષ્યની તારીખે ફરીથી બૂક કરાવવાની જરૂર પડી શકે.
- ઈમારતમાં પ્રવેશતા પહેલાં હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- તમે અને અન્ય લોકો વચ્ચે ઓછામાં ઓછું 2 મીટર (6 ફૂટ)નું શારીરિક અંતર જાળવો.
- નોન-મેડિકલ ફેસિયલ માસ્ક પહેરવા અનિવાર્ય છે.

મનોરંજન કેન્દ્રો (રિક્રિએશન સેન્ટર્સ)

પસંદગીની સીટી ઓફ બ્રેમ્પટન મનોરંજન સગવડો માત્ર આરક્ષિત એપોઇન્ટમેન્ટ્સથી સપ્ટેમ્બર 8 નાં રોજ ફરીથી ખોલવામાં આવી. ઉપલબ્ધ કાર્યક્રમ ક્ષેત્રોમાં ફિટનેસ, જળક્રીડા (એક્ટિવિટી), સામાન્ય રસપ્રદ કાર્યક્રમો અને સ્કેટિંગનો સમાવેશ થાય છે. રહેવાસીઓ રિઝર્વેશન ટાઇમસ્લોટ્સ જોઈને પોતાની મુલાકાત અહીં વેબસાઇટ www.brampton.ca/recreation પર રજીસ્ટર્ડ અને ડ્રોપ-ઇન કાર્યક્રમો વેબ પેજ જોઈને નિર્ધારિત કરાવી શકે છે. રિઝર્વેશન્સ અગાઉથી સાત દિવસ સુધી સ્વીકારવામાં આવે છે. વૈકલ્પિક રીતે, રહેવાસીઓ 311 નંબર પર કોલ કરીને રિઝર્વેશન બૂક કરાવી શકે.

સીટીની સગવડોમાં વધારે સારા સુરક્ષા પગલાઓ

ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો અને પીલ પબ્લિક હેલ્થને અનુરૂપ થઈને, સીટી ઓફ બ્રેમ્પટન સગવડોને સુરક્ષિત રાખવા વધારે સારા પગલાઓનો અમલ કરવાનું ચાલુ રાખશે. આ પ્રોટોકોલ્સ મુલાકાતીઓ, ઈજરદારો, ગ્રાહકો અને કર્મચારીઓ સહિતની વ્યક્તિઓને સંભવિત જોખમો સામે સંરક્ષણ આપવામાં, રોકવામાં અને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

વધારે સારા સુરક્ષા પગલાઓમાં સામેલ છે:

- સક્રિય સ્ક્રીનિંગ
- ફેસ કવરીંગ્સ અને અંગત સંરક્ષણાત્મક સાધન (PPE)
- જનતા-સામે (પબ્લિક-ફેસિંગ) કાઉન્ટર અવરોધકો (બેરિયર્સ)
- સેનિટાઇઝિંગ
- સફાઈ અને ચેપરહિતકરણ
- સાઈનેજ
- ક્ષમતા નિયંત્રણ
- વહેંચાયેલી કાર્ય જગ્યાઓ પર પ્રતિબંધો

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સમુદાયને સહાયરૂપ થવા સીટીના પ્રયત્નો પર વધુ માહિતી મેળવવા વેબસાઇટ

જુઓ, www.brampton.ca/COVID19 અથવા [Twitter](https://twitter.com/CityBrampton), [Facebook](https://www.facebook.com/CityBrampton) અને [Instagram](https://www.instagram.com/CityBrampton) પર @CityBrampton ને અનુસરો.

આ શહેરના બાય-લોઝ (પેટા-કાનૂનો) પર વધુ માહિતી મેળવવા વેબસાઇટ જુઓ, www.brampton.ca

-30-

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहान्मक संवाढ

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca